



RAN-2308000601060013

F.Y.B.Com. (NEP) (Sem. I) Examination November - 2025
SEC - Total Credit - 2 : Tax Procedure and Practice (Paper - I)

Time: 1 Hours]

[Total Marks: 25

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
 Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. ટૂંકા પ્રશ્નો. (7 માંથી કોઈપણ 5 જવાબ આપો)

(10)

1. કર આયોજન શું છે?
2. પરોક્ષ કરની લાક્ષણિકતાઓ જણાવો.
3. સંપૂર્ણ ફોર્મ આપો: CBDT, ITC
4. આવકવેરાની ગણતરી કરવાની પદ્ધતિઓ જણાવો.
5. આકારણી વર્ષ 2025-26 માટે નવી કર વ્યવસ્થા મુજબ આવકવેરા સ્લેબ દરો જણાવો.
6. રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતા કોઈપણ ચાર પરોક્ષ કરની સૂચિ આપો જે GST માં સમાવેશ કરવામાં આવ્યા છે.
7. GST વ્યાખ્યાયિત કરો.

પ્ર.2. પ્રત્યક્ષ કર ની વ્યાખ્યા આપો. તેની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ સમજાવો.

(15)

અથવા

પ્ર.2 1. યોગ્ય ઉદાહરણ સાથે ઈનપુટ ટેક્સ ક્રેડિટ સમજાવો.

(07)

2. આકારણી વર્ષ 2025-26 માટે ભારત ના રહીશ 70 વર્ષના શ્રી સજ્જન ની કુલ આવક રૂ. 10,80,500 છે. નીચે પ્રમાણે તેમની ચૂકવવાપાત્ર આવકવેરો ગણતરી કરો.
- (a) જૂની કર વ્યવસ્થા મુજબ
- (b) નવી કર વ્યવસ્થા મુજબ

(08)

ENGLISH VERSION

Q.1. Short Questions (Answer any 5 out of 7)

(10)

1. What is Tax Planning?
2. Enlist the Characteristics of Indirect tax.
3. Give full form: CBDT, ITC
4. State the Methods of calculating Income Tax.
5. Provide the Income tax slab rates as per New tax regime for A.Y. 2025-26.
6. List any four indirect taxes levied by State Government which has been subsumed under GST.
7. Define GST?

Q.2. Define Direct tax. Explain its Characteristics and limitations. (15)

OR

Q.2. Write the following answer:

1. Explain the Input tax Credit with Suitable Example. (07)
2. Total Income of Mr. Sajjan aged 50 years resident in India, for the Assessment year 2025-26 is Rs. 10,80,500. Compute his tax liability as under : (08)
 - (a) As per Old Regime
 - (b) As per New Tax Regime
